





8th May, 2024

To,

The Manager (Listing),	The Manager (Listing),
The BSE Ltd.	National Stock Exchange of India Ltd.
Mumbai	Mumbai
Company's Scrip Code: 505700	Company's Scrip Code: ELECON

Sub: Notice to the Shareholders for transfer of Equity Shares to Investor Education

and Protection Fund (IEPF) Authority

Ref : Intimation under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure

Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

With reference to the subject referred Regulation, we would like to inform you that a Notice to the Shareholders of the Company pertaining to transfer of Equity Shares to the Demat Account of the Investor Education and Protection Fund (IEPF) Authority has been published in The Business Standard Newspaper (English) & Jay Hind Newspaper (Gujarati) on 7th May, 2024.

A copy of the said newspaper advertisements are enclosed for your reference & records.

Thanking you.

Yours faithfully, For Elecon Engineering Company Limited

Bharti Isarani Company Secretary & Compliance Officer

Encl.: As above













Power Industry









Gearing industries. Gearing economies.

PUBLIC NOTICE

of M/s. SANTOSH ASSOCIATES, A partnership firm; On its behalf and from them; had bought a property which is situated Moje:-Ahmedabad City'S East:- Ahmedabad-11 (Aslali), Sr. No. 1410/1 and 1410/2; whih is N. A.LAND; bearing T. P. Scheme No.;-128 ; F. P. No. 327 7402 sq. mtrs. Land paikee Undivided land of 25.15 sq. mtrs. Land and on that particular land "SHAN-3" namely constructed property in residential scheme, and on it's block no. A-1, a flat of No.31 of said building's third floor; said fat admeasures total area of 676 sq. feet i.e. 59.09 sq. mtrs. Bearing property; for the same sale consideration amount was paid up and said property's sale deed was registered at sub registrar -11 Aslali Ahmedabad registrar office with document no.7346/2013. Once when I was coming to paldi Kankaj from kamod; at that time I had kept said Document is one plastic bag with me. And said plastic bag was hang on bike's hook belonged to me. But unfortunately by mistake said plastic bag was misplaced somehow somewhere on the road. But Even after searching for said bag very hard; I couldn't manage to find if and thus the document which was kept is aid plastic bag was also untimely lost. For lost Original document, I had filed a complaint in Aslali Police Station. If anybody finds this documents, please inform to Aslali Police Station. And if anybody has any kind of objection, or dispute regarding said documents, please inform us within 7 days. And not to make any transaction deal transfer buy or sell regarding said Original document otherwise there shall be lost of money and my client shall be compelled to take legal action against such transaction; and please take a serious note of it. Place: Ahmedabad, Date: 06/05/2024

(Sanjaysingh Katariya) Advocate Residing:-Paldi Kankaj, Ta. Daskroi, Dist. Ahmedabad. Mo.9998186353, 6355972488



Ring Road Branch : Near Rushabh Petrol Pump, Man Darwaja, Ring Road, Surat - 395002, Tel.No. 0261 - 2398400 Email : bm1118@unionbankofindia.com

Interest (Enforcement) Rules, 2002 **POSSESSION NOTICE** (for immovable property)

Where As, The Undersigned Being The Authorized Officer Of Union Bank Of India Under The Securitization And Reconstruction Of Financial Assets And Enforcement O ecurity Interest Act, 2002 And In Exercise Of The Powers Conferred To Him Under Section 13(12) Read With Rule 3 Of The Security Interest (Enforcement), Rules, 2002 ssued A Demand Notice Dated 18/06/2021 Calling Upon The Borrower/ Guaranto Mrs. Rekha Devi Kabra Alias Rekha Sushil Kabra (Borrower & Mortgagor), Mr Suresh Kumar Ladha (Guarantor) To Repay The Amount Mentioned In The Notice Being Rs.18,93,370/- (Rupees Eighteen Lakh Ninety-Three Thousand Three Hundred Seventy Only) As On 18/06/2021 + Further Interest And Other Expenses Within 60 Days From The Date Of Receipt Of The Said Notice.

The Borrower/ Guarantor Having Failed To Repay The Amount, Notice Is Hereby Given

To The Borrower/Guarantor And The Public In General That The Undersigned Has Taken Physical Possession Of The Property Described Herein Below In Exercise O he Powers Conferred On Him Under Section 13(4) Of The Said Act Read With Rule 8 Of The Said Rules On 05/05/2024

he Borrowers/Guarantors In Particular And The Public In General Are Hereby Cautioned Not To Deal With The Properties And Any Dealings With The Properties Will Be Subject To The Charge Of **Union Bank Of India, Ring Road Branch** For An Amount Rs.18,93,370/- (Rupees Eighteen Lakh Ninety-Three Thousand Three Hundred Seventy Only) As On 18/06/2021 in the said account together with costs and interest as aforesaid.

The Borrower's Attention Is Invited To The Provision Of Sub-Section (8) Of Section 13 Of The Act, In Respect Of Time Available, To Redeem The Secured Assets

Description of immovable property

All right title and interest in Flat No.A-102 admeasuring 1020 sq.fts equivalent to 94.80 sq.mtrs its built up area 88.18 sq.mtrs on 1" floor, together with undivided proportionate share in underneath land admeasuring 17.76 sq.mtrs and 7.10 sq.mtrs of "Siddhi Tower of Samarth Park" situated on the land bearing Revenue Survey No.625/1+2, T.P. Scheme No.12, F.P. No.BS, at: Village: Adajan, Taluka: Choryasi, Dist: Surat. Bounded As: East Open Space, West: Flat No. 101, North: Open Space, South: Passage

Authorised Office Date : 05/05/2024 Place : Surat

notice within 60 days from the date of receipt of the said notice.

Opp. Express Hotel, R.C.Dutt Road.

Alkapuri, Vadodara. Tel. 0265-2338115

Where as, The undersigned being the Authorised Officer of Canara Bank (Erstwhile Syndicate Bank), under the

Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002)

(hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with rule 3 of Security

Interest (Enforcement) Rules 2002, issued Demand notice calling upon the borrower to repay the amount mentioned in the

The borrower/surety/owner of the property having failed to repay the amount, notice is hereby given to the borrower/s guarantor and the public in general that the undersigned has taken Possession of the property described herein below in

exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 & 9 of the Security Interest

The owner of the property, borrower/s and guarantors in particular and the public in general is hereby cautioned not to deal with

the property and any dealings with the properties will be subject to the charge of Canara Bank, for an amount mentioned here

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section (13) of the Act, in respect of the time available, to

in below and payable together with all costs, charges, expenses and incidental expenses thereon.

Demand Notice Date & Amount(Rs.

Dt: 26.02.2024 &

Rs. 24.05.276.94

(Rupees Twenty Four

Lakhs Five Thousand

Two Hundred Seventy

Six and paise Ninety

Four only)

Dt: 27.02.2024 &

Rs. 13,40,770.34

(Rupees Thirteen lakh

Forty thousand Seven

Hundred Seventy and

paise Thirty Four only)

केनरा बैंक Canara Bank 📣

Enforcement) Rules, 2002.

edeem the secured assets.

Sr Branch & Borrower's /

Branch

Thakor

(Borrower)

No Guarantor / Mortgagor Nam Vadodara Fatehgunj

M/s Aditashya Corporation

Paresh N Patanvadiya,

Patanvadiya (Proprietor)

(Guarantor& Mortgagor)

Anwarhusen Abdulrahim

Guarantor and Legal heir

of Late Abdulrahim

(Kalubhai Bhathiyara)

Abdulrahim Kalubhai

Abdulrahim Bhathiyara

Johrabibi Abdulrahim

Naranbhai Ganpatbhai

S/o Narayanbhai

Nadiad Branch M/S EMPIRE BAKERY

Bhathiyara

Bhathiyara

Bhathiyara)

Ahemadhusen

(Legal heir of Late

PUBLIC NOTICE

IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD R/FIRST APPEAL No. 3870 of 2007

FIXED ON 18/06/2024 District: AHMEDABAD

Mr. PRANAV G. DESAI Ld. Advocate for the Appellan STATE BANK OF INDIA ..Appellant

VERSUS

AHMEDABAD DISTRICT CO.OP.BANK LTD. & OTHERSDefendant(s) 7. HIRUBHAI SHIVABHAI PATEL

VISHNUKRUPA SOCIETY, FATEHGANJ, VADODARA 8. DEEPAK CHIMANBHAI

23. RR PARK, KARELIBAG, VADODARA

12. HASUBHAI ALIAS HEMENDRA PRABHUDAS PATEL 17. RAJGIRI SOCIETY, KARELIBAG, VADODARA-18

Take notice that the Appellant above-named having presented a R/FIRST APPEAL No. 3870 OF 2007 against the Judgment and decree dated 11/05/2007 passed by Judge, Court No.16, City Civil and Sessions Court, Ahmedabad city in Civil Suit No 2433/2005 and the same having been registered in this court on 16/07/2007.

Whereas upon hearing and allowing the CIVIL APPLICATION No. 3 OF 2024 (For Substitute Service) in R/FIRST APPEAL No. 3870 OF 2007, the Honourable Court (Coram: ADDITIONAL REGISTRAR (JUDICIAL) MR. M.K. UPADHYAY) or 05/04/2024, had been pleased to pass the order to issue Notice of Rule to unserved Respondent no.7,8 and 12 by publication of the notice in vernacular language and another in English language newspaper havig wide circulation in the city of

Take NOTICE that the hearing of the said R/FIRST APPEAL No. 3870 OF 2007 wil take place on 18th day of June, 2024 at 11 am peremptorily in this Court and if no appearance is made either by you or on your behalf, your advocate or by someone authorized by law to act for you the Court shall proceed to pass appropriate orders and it will be heard and determined in your absence.

Witness SUNITA AGARWAL, Esquire the Chief Justice at Ahmedabad aforesaid this 05th day of April, 2024. By the Court



(H.D.PUROHIT) Assistant Registrar

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Imi [As per Rule 8(1) read with Rule 8(2) and Appendix IV of Security Interest nforcement) Rules, 2002 and read with Section 13(4) of SARFAESI Act, 2002]

Whereas. The undersigned being the authorized officer of the **Rank of Raroda** under whereas, the undersigned being the authorized blice of the Baha of Bahada under he Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security terest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 10.01.2024 calling upon the borrowers Mr. Drivedi Sankarlal R (Borrower) and Mrs. Shabana Shankarlal Drivedi (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs.19,15,162.38/ (Rupees Nineteen Lakh Fiteen Thousand One Hundread Sixty Two Rupess Thirty Eight Paise only) (inclusive of unapplied interest, uncharged interest, and other charges) along with urther contractual interest thereon within 60 days from the date of receipt of the said

The borrowers having failed to repay the amount, notice is hereby given to the porrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under subsection (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this **04* Day of May in the year 2024.** The borrowers' attention is invited to provisions of sub-section (8) of section 13 of the

Act in respect of time available, to redeem the secured assets.

he borrowers in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs. 19,15,162.38 /- (Rupees Nineteen Lakh Fiteen Thousand One Hundread Sixty Two Rupess Thirty Eight Paise only) along with urther interest and other charges thereon.

Description of immovable property

All that part, piece and parcel of the immovable property bearing Flat number 201, admeasuring about build up area adm 587 sq ft i.e 54.52 sq mts carpet area adm 500.00 sq ft i.e 46.48 sq mtrs, its wash and balcony total area 4.85 sq mtrs situated on the 2nd floor together with undivided proportionate share in the land admeasuring about 22.17 sq mtrs underneath the said building no B/2 of Nilkanth height constructed in the land bearing Revenue survey number 25, Block number 49 of TF scheme no 34 (Pali- Sachin-Kansad), FP No 28 situated at village Pali District Surat Bub District Choryasi and bounded : On the East by: Adj School & Play Garden, On the Nest by : Adj Road, On the North by : Adj Road, On the South by : Adj Block No 48/A. The above property was mortgaged with Bank of Baroda through Instrument of Deposit of Title deed bearing registration number 9398 dated 9398 dated 03.12.2022 registered with sub registrar Palsana. CERSAI registered with security 400067463065 **Authorised Officer.**

Date: 04-05-2024 | Place: Surat

Main Road, Vyara Branch (60375), Dist.Tapi (Guj) Ph: 7600039329, E-mail sbi.60375@sbi.co.in,

A notice is hereby given that the following Borrower's & Guarantor's have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have been returned unserved and as such they are hereby informed by way of this public notice.

Name of the Borrower	Details of Properties/ Address of Secured Assets to be Enforced	Date of Notice Date of NPA	Amount Outstanding (as on the Date of Notice)
Mr. Kalubhai Shaibali Ansari	All that piece and parcel of immovable property bearing Shop Plot No - 23 - D, "Barsana Residency", Block No. 443 (After KJP Block No. 443/D-23), Kanpura Tal. Vyara, Dist. Tapi (Guj) - 394650 admeasuring 47.28 sq. meter. Bounded as below. On or towards East by: Plot No. 24-D, On or towards West by: Plot No. 22-D, On or towards North by: Boad. On or	13/12/2023 10/12/2023	HL A/C No. 39671098016 8 SURAKSHA LODA A/C No. 397 35498977 Rs.15,85,147/-); on 12/12/2023 with further intereincidental expenses, cost, charges, etc.,

The steps are being taken for substituted service of notice. The above Borrower(s) and /or their Guarantor(s) (whenever applicable) are hereby called upon to make payment of outstanding amount within 60 days from the date of publication of this notice, failing which further steps will be taken after expiry of 60 days from the date of this notice under sub-section (4) of Section 13 of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002.

towards South by: Block No. 444.

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

Authorised Officer, State Bank of India Date: 13/12/2023

NOTICE

Notice is hereby given that the share certificates for 1500 equity shares o Rs.2/- each (Cert. no. 15423 Distinctive no. 37200211 to 37200960 for 750 shares, and Cert. no. 3390 Distinctive no. 2586586 to 258733 for 750 shares) under Folio No 00S01883 standing in the name o SHYAM LAL NOPANY o SUDARSHAN CHEMICAI SUDARSHAN CHEMICAI lost. Undersigned have applied fo duplicate share certificate(s). Any person(s) who have claim should odge claim with the Company at it Registered Office within 15 days Registered Office: 7th Floor, Elever West Panchshil, Survey No. 25, Nea PAN Card Club Road, Baner, Pune

Date: 06/05/2024 Legal Heir: Gayatri Devi Nopan Place : Bilaspur

(For Immovable Property)

[Appendix IV under the Act - Rule 8(1)]

Possessior

Date & Type

01.05.2024

Symbolic

04.05.2024

Symbolic

CANARA BANK - REGIONAL OFFICE POSS SSION NOT ():

Description of the Property

All the piece and parcel of non agricultural plot o

land in Mauje Dumad, Vadodara lying being

land bearing Tikka no. 3, C.S.no. 23

admeasuring 35.4172 Sq.Mtrs., at Registratio

District Vadodara & Sub district & District

Vadodara. Bounded: East- By Open Plot الا

Pond, West- By Road & House, North- By

House of Bakorbhai Shivabhai Thakor, South

All the piece and parcel of land and building a

Tika No 3, City Survey No 61, (Consolidated

City Survey No 62, 63, 64) in Nadiad Naga

Palika, Ward No 7, House No 1698, Tota

Admeasuring 73-78-87 Sg mtr Situated at Ram

Faliya, Empire Bakery, Nadiad, Distt Kheda

Gujarat in the name of Late ABDULRAHIM

KALUBHAI BHATHIYARA, Boundaries: North

City Survey No. 61 paiki, South- City Survey No

65, East-Road/Gali, West-Gali

By Road & House of Bhikhabhai Somabhai.

HDFC BANK HDFC Bank Ltd.

201-204 Riddhi Shoppers, Opp. Imperial Square, Adajan-Hazira Road, Adajan, Surat-395 009 Ph.No.0261-4141212 NOTICE

HDFC Bank Ltd.

Whereas the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having analgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbal vide order dated 17th March 2023 (HDFC), under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Said Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of of the said Notice/s, incidental expenses, costs, charges etcill the date of payment and / or realisation.

ı -	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues Rs. as on Dt	Demand Notice	Date of Possession/ Physical /Symbolic	Property (ies) / Secured Asset (s)
1	Mr Darji Pravinkumar Khemchandbhai (Borrower), Mrs Darji Indiraben Pravinkumar (Co-Borrower) 163470-640656972,635435838	Rs.3,46,833/- Rs.44,32,960/- as on 30-JUN-2023	18- JUL- 2023	PHYSICAL	Flat-202, Floor- 2nd, Kashtbhanjan Livino Type as no 48/2, B/s. Kantheriya Hanumanji Temple, Opp. Mansi flats, River Park Society, Cozway Road, Singanpor, Surat-395004.
*with further interest as applicable, incidental expenses, easts, sharpes etc incurred till the date of payment and / or realisation					

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation. However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorised Officer/s of HDFC have taken physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of

asset(s) described nerein above in exercise or powers conterred on infinitely under Section 15 (4) of the said Australia Hills and Rules on the dates mentioned above. The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC. Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset/s. Copies of the Panchnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) /

egal Representative(s)is / are requested to collect the respective copy from the undersigned on any working day during r ffice hours. For HDFC Bank Ltd. Date: 05/05/2024

Authorised Officer. Place : SURAT

Government of India भारत सरकार Ministry of Finance वित मंत्रालय

Debts Recovery Tribuna-II त्रण वसूली अधिकरण -II 3rd Floor, Bhikhubhai Chambers तीसरा माला, भिखुभाई चेम्बर्स Near Kochrab Ashram, Paldi, कोचरब आश्रम के पास, पालडी, Ahmedabad, Gujarat अहमदाबाद, गुजरात

FORM NO. 22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations 2015] [See Rule 52 (1) (2) of the Second Schedule to the Income Tax Act, 1961

READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT. 1993

E-AUCTION SALE NOTICE

THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM/PUBLICATION

RP/RC No.	588/2018	OA No. 1358/2017			
Certificate Holder Bank B		Bank of Baroda			
Vs.					
Certificate Debtors	;	Devrajbhai Dulabhai Sachapara & Ors.			

C.D.No.1: Devrajbhai Dulabhai Sachapara, C.D.No.2: Davabhai Dulabhai Sachapara.

C.D.No.3: Chhaganbhai Dulabhai Sachapara, Defendant No. 1 to 3

all resident of Village Gutal, Taluka Waghodia, District Vadodara C.D.No.4: Jayantbhai Haribhai Shiroya, B-75, Amardeep Society, Opp. Yogeshwar Township, Ajva

Road, Vadodara-380 019 C.D.No.5: Desaibhai Gemabhai Parmar, 4/20, Vachala Karamsiya, Post Kheda Kaeamsiya, Taluka

Waghodia, District Vadodara. The aforesaid CDs No. 1 - 5 have failed to pay the outstanding dues of Rs. 45,53,503.85 (Rupees Forty Five Lakhs Fifty

Three Thousand Five Hundred Three and Eighty Five Paisa only) as on 25/09/2018 including interest in terms of judgmen and decree dated 25/09/2018 passed in O.A.No. 1358/2017 as per my order dated 29/04/2024 the under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction https://drt.auctiontiger.net.

Lot No.	Description of the property	Reserve Price (Rounded off)	EMD 10% or (Rounded off)
01.	Free Hold, subject property is an agriculture Open Land located at Block / R.S. 783, 784 & 845 at Mouje Village Gutal, Tal. Waghodia, Dist. Vadodara, Gujarat.	Rs. 212.00 Lakhs	Rs. 21.20 Lakhs
02	Free Hold, subject property is an agriculture Open Land located at Block / R.S. 854, 855, 857, 860 & 779 at Mouje Village Gutal, Tal. Waghodia, Dist. Vadodara, Gujarat.	Rs. 264.00 Lakhs	Rs. 26.40 Lakhs
03	Free Hold, subject property is an agriculture Open Land located at Block / R.S. 840, at Mouje Village Gutal, Tal. Waghodia, Dist. Vadodara, Gujarat.	Rs. 81.00 Lakhs	Rs. 8.10 Lakhs

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993 (as amended in the year 2016).

EMD shall be deposited by through RTGS/NEFT in the account as per details as under: Beneficiary Bank Name Bank of Baroda

Beneficiary Bank Address Jarod Branch, Jarod, Baroda Beneficiary Account No. 06360500000562 & 06360500000563 & 06360600001315 IFSC Code BARBOJARODX 1) The bid increase amount will be **Rs. 10,000/-** for lot no 1 to 3.

2) Prospective bidders may avail online training from service provider M/s E-Procrement Technologies Ltd. (Tel Helpline

No.9265562821-079 61200594/598/568/587/538 and Mr. Ram Sharma (Mobile No. 09978591888), Helpline E-mail ID: support@auctiontiger.net & Ramprasad@auctiontiger.net and for any property related queries may contact **Mr. Riya Variya**, (Mob. No. 8820021999). 3) Prospective bidders are advised to visit website https://drt.auctiontiger.net for detailed terms & conditions and procedure

of sale before submitting their bids. 4) The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of

hammer/close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained. 5) The properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are

advised to carry out due diligence properly 6) Schedule of auction is as under

SCHEDULE OF AUCTION

1 Inspection of Property 22/05/2024 Between 11.00am to 2.00pm Last date for receiving bids along with earnest money and 11/06/2024 Upto 05.00pm 2 uploading documents including proof of payment made 12/06/2024 (Between 12.00pm to 01.00pm (with 3 E-Auction auto extension clause of 03 minutes, till E Auctiob ends.)

> Recovery Officer - II Debts Recovery Tribunal - II AHMEDABAD

Whereas, the undersigned being the Authorized Officer of the Bank of Baroda unde

landini Chowk Branch, Sayaji Road, Navsari-396445 Phone - +91 02637-234801,

APPENDIX IV [See Rule 8(1)] POSSESSION NOTICE

the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read witf [rule 3] of the Security Interest (Enforcement) Rules, 2002, issued demand notice dated 09.01.2024 calling upon Mr. Manhar Pragjibhai Dhoriyani (Borrower) Mrs Hansaben Manharbhai Dhoriyani, (Borrower and Mortgagor) and Mr. Vijaybha Mohanbhai Kakasaniya & Mr. Hitesh Arjanbhai Nagpara (Guarantors) to repay the amount mentioned in the notice being Rs. 3,46,396.05 (Rupees Three Lac Forty Six Thousand Three Hundred Ninety Six and Paisa Five Only) as on 31.01.2024 inclusive of interest up to 31.01.2024) and further interest thereon within 60 days from the date of receipt of the said notice

The Borrowers/Guarantors/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/ Guarantors/ Mortgagor, and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 1st Day of May of the year 2024.

The Borrowers/ Guarantors/ Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property wil e subject to the charge of the Bank of Baroda for an amount of Rs. 3,46,396.05 Rupees Three Lac Forty Six Thousand Three Hundred Ninety Six and Paisa Five Only) as on 31.01.2024 (inclusive of interest up to 31.01.2024) and further interes

and expenses till full and final payment. The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the immovable property

All the piece and parcel of immovable property bearing City Survey Tika No. 40 City Survey 2224, Paiki Flat No. B/406, Municipal House No. 3103, with super built up area admeasuring 504 sq. fts. situated at Jay Somnath Co-operative Housing Society Ltd., behind Somnath Temple, Municipal Ward No. 2/1 Shantadevi Road, Navsari in the name of Mrs. Hansaben Manharbhai Dhoriyan and bounded as follows : East: Flat No. B/405. West: OTS of Open Land. North: A wing of Somnath Apartment, South: Flat No. B/407

Date: 01.05.2024

Chief Manager & Authorised Officer

@ELECON

ELECON ENGINEERING COMPANY LIMITED CIN: L29100GJ1960PLC001082

Regd. Office: Anand-Sojitra Road, Vallabh Vidyanagar-388 120. Ph: (02692) 238701-238702.

Email: investor.relations@elecon.com Website: www.elecon.com

NOTICE

(for the attention of Equity Shareholders of the Company Sub: (1) Reminder to claim the dividends remaining unpaid / unclaimed. (2) Transfer of unclaimed equity shares of the Company to the

Investor Education and Protection Fund (IEPF). (3) Mandatory updation of PAN and Bank details against your holding(s).

NOTICE is hereby given pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 ('The Act') read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ('The Rules') notified by the Ministry of Corporate Affairs (MCA), Government of India, and subsequent amendments thereto, the dividend declared during the financial year 2016-17, which remained unclaimed for a consecutive period of seven years will be credited to the IEPF. The Corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be

transferred as per the procedures set out in the rules. The Company will not transfer such shares to the IEPF where there specific order of Court/Tribunal restraining any transfer of such shares or where the shares are hypothecated/pledged under the Depositories Act, 1996.

The Company has communicated individually to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF under the said Rules for taking appropriate action(s).

Shareholders are requested to claim the dividends, if any, remaining unpaid/ unclaimed from the financial year 2016-17 and onwards before the same is transferred to the IEPF by making application to Link Intime India Private Limited, Registrar and Share Transfer Agent (RTA) of the Company.

The concerned shareholders holding shares in Physical form and whose shares are liable to be transferred to IEPF, may please note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of original shares certificate(s) held by them for the purpose of conversion into DEMAT form and subsequent transfer in DEMAT Account of IEPF Authority. The original share certificate(s) which are registered in the name of the original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Further, the concerned shareholders who are holding shares in DEMAT form, may please note that the transfer of share in DEMAT account of the IEPF Authority will be effected by the Company through the respective Depository

by way of Corporate Action. In case the Company does not receive any communication from the concerned shareholder on or before 15th August, 2024 the Company shall credit those shares with the IEPF Authority. Any further Dividend on such shares shall be credited to the IEPF. The concerned shareholder may further note that upon credit of such shares to the said DEMAT Account, no claim shall lie against the Company in respect of the unclaimed dividend amount and the shares transferred to IEPF Demat Account. However, shareholder(s) may claim back the shares credited alongwith the unclaimed dividend amount from IEPF Authority after following the procedure prescribed under the IEPF Rules. The

procedure for claiming the same is available at www.iepf.gov.in. As ner SEBI circulars, shareholders whose ledger folios are not manned with PAN, Email Id. Nomination details and Bank Account details are requested to compulsorily furnish the details to the RTA for registering the same with respective folio(s).


In case the shareholder(s) have any queries on the subject matter, they may contact to the Company at the contact details given above or contact Company's RTA at following address:

Link Intime India Private Limited, Unit: Elecon Engineering Company Limited, Geetakunj, 1 Bhakti Nagar Society, Behind A B S Tower, Old Padra Road, Vadodara 390015, Tel: +91 - 265 3566768, Email: vadodara@linkintime.co.in, Website: www.linkintime.co.in

For Elecon Engineering Company Limited, Place : Vallabh Vidyanagar Bharti Isarani (Company Secretary)



Date: 07.05.2024 - Place: Vadodara



Bhathiyara) Bismilaben Abdulrahim **Bhathivara** (Legal heir of Late Abdulrahim Kalubhai Bhathivara) Salimben Abdulrahim Bhathivara (Legal heir of Late Abdulrahim Kalubhai Bhathivara) Ismailbhai Abdulrahim Bhathiyara (Legal heir of Late Abdulrahim Kalubhai

Bhathiyara) Naseemben Abdulrahim Bhathiyara (Legal heir of Late Abdulrahim Kalubhai

3hathivara)

Branch

Bilkisbanu Abdulrahim Bhathiyara (Legal heir of Late Abdulrahim Kalubhai 3hathiyara) Salmabanu Abdulrahim Bhathiyara (Legal heir of Late Abdulrahim Kalubhai Bhathivara)

Dt: 22.02.2024 & Rs. 21,12,075/-Vadodara Manialpur (Rupees Twenty One Vishal Jayantibhai Gajjar Lakhs Twelve (Borrower) Thousand Seventy Five only)

land Mauje Atladara, Vadodara lying bearing Final Plot No. 71, Old R.S.No. 417/2/4 Paikki, F

P. No. 71, O.P. no. 71, C.S. no. 1288 Tota admeasuring 16146 Sq. Fts. T.P. Scheme no. 20 admeasuring 1500 Sq. Mtrs. Known as "MAPLE MEADOWS" Paikki First Floor, flat no. B 106.Construction admeasuring 63.25 Sq. mtrs 02.05.2024 , i.e, 680.88 Sq. Fts., Built up & Open Terrace & Undivided Share of Common Plot admeasuring 21.11 Sq. Mtrs., i.e, 227.27 Sq. Fts. A Registration Sub District & District Vadodara Bounded: North: By Kailashpark Society, South : By Tower A-2, East : By Flat No. B-103, West By Hiranagar Society.

All the piece and parcel of non agricultural plot o







SEAL





















Date: 6th May, 2024

ઈઝરાયેલનું ફિલીસ્તીઓને રાફા છોડવા અલ્ટીમેટમઃ મોટા હમલાની આશંકા

કે રાકામાં હજારો હમાસ લડાયકો અને બંધકોને શરણમાં રાખ્યા છે

ગત વર્ષથી શરૂ થયેલ ઈઝરાયેલ હમાસ વચ્ચેનું યુધ્ધ બંધ થવાનું નામ ઈઝરાયેલી સેના માને છે લેતું નથી. હવે ઈઝરાયેલની રાફા પર નજર મંડાઈ છે. અહીં તે કોઈપણ સમયે હમલો કરી શકે છે. ઈઝરાયેલની સેનાએ પિલીસ્તીની નાગરિકોને પૂર્વી રાફા ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ઉક્ષેખનીય છે કે અહીં ૧૦ લાખથી વધુ યુધ્ધ

આવકવેરા વિભાગનું કહેવું હતું કે જે

વિસ્થાપિત ફિલીસ્તીનીઓએ શરણ લીધી છે.

અરબી સંદેશા, ટેલીફોન કોલ, ફ્લાયર્સથી ઈઝરાયેલી સેનાએ ફિલીસ્તીનીઓને ૨૦ કિલોમીટર દુર વિસ્તારિત માનવીય ક્ષેત્ર કહેવાતા સ્થળ પર જવાનો નિર્દેશ કર્યો છે. ઈઝરાયેલી સેનાનું માનવું છે કે રાફામાં હમાસના હજારો લડાયકો અને સંભવિત રીતે ડઝનબંધ બંધકોને શરણમાં રાખ્યા છે. સેનાનું માનવું છે કે રાફાને હરાવ્યા વિના જીત સંભવ નથી.

હાઈકોર્ટના આદેશથી શાળાઓને

રાહત અને વાલીઓને ઝટકો

દિલ્હીની મોટી મોટી આવામાં શાળા એકલી કેમ તેના

શાળાઓમાં પોતાના વ્હાલાસોયા ખર્ચનો બોજો ઉઠાવે? આ સુવિધા

બાળકોનું એડમિશન કરાવવા લેબ જેવી સુવિધાઓથી અલગ

ઈચ્છતા માતા પિતા હવે નથી. શાળા મેનેજમેન્ટ તરફથી

ક્લાસરૂમમાં જો એસીની સુવિધા કહેવાયું કે એસીની ફી રસીદમાં

ઈચ્છતા હોય તો તેનો ખર્ચો નોંધાયેલી છે. દિલ્હી હાઈકોર્ટના

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એસી

દિલ્હી હાઈકોર્ટે **બાળકોની સુવિધા માટે લગાવવામાં** જ સ્ટિસ સ શાળામાં એસીનો **બાળકોની સુવિધા માટે લગાવવામાં** મનમોહન અને

ચાર્જ વસૂલવા **આવે છે, આવામાં શાળા એકલી** જસ્ટિસ મનમીત

કેમ તેનો ખર્ચો ઉઠાવે?

પર ટિપ્પણી કરતા કહ્યું કે એસી પોતાના નિર્ણયમાં સ્પષ્ટ શબ્દોમાં

બાળકોની સુવિધા માટે લગાવવામાં કહ્યું કે હાલ એડમિશનનો સમય છે.

આવે છે. આવામાં શાળા એકલી વાલીઓ પોતાના બાળકોનું

વાત જાણે એમ છે કે દિલ્હીની શરતો, ફ્રી અને અન્ય બાબતો

પબ્લિક સ્કૂલમાં નવમાં ધોરણના ધ્યાનથી વાંચે અને સમજે. કારણ કે

વિદ્યાર્થીના પિતાએ હાઈકોર્ટમાં અનેક સુવિધાઓ અધ્યયન

અરજી દાખલ કરીને શાળા તરફથી અધ્યાપનથી અલગ હોય છે.

નવી દિલ્હી, તા. ક આવે છે અને ચલાવવામાં આવે છે.



સંયુકત રાષ્ટ્રસંઘ (યુએન)માં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે ભારતની પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓના નેતૃત્વમાં થયેલી નોંધપાત્ર પ્રગતિના ભરપૂર પ્રશંસા કરી હતી. ન્યૂયોર્ક સ્થિત યુએન મથક ખાતે ભારત દ્વારા આયોજીત સીબીડી ૫૭ કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ભારતની ગાસરૂટ પંચાયતી રાજની મહિલા નેતાઓ સાથે રૂચિતા કંબોઝ (ડાબેથી બીજા) ગૃપ પોઝ આપી

રાજકોટ તા. ૬ નિકળતા પુનઃ તેજીના માર્ગે દોડવા લાગ્યુ

માહોલ વચ્ચે મીશ્ર વલણ રહ્યું હતું. આવતીકાલે ત્રીજા તબકકાના ચૂંટણી મતદાન તથા માર્કેટમાં ગેરરીતિ થઈ રહ્યાની ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ચેતવણીથી માનસ સાવચેતીનું હતું.

તેજીના ટોને થઈ હતી. ઉછાળે આંકડાના આધારે માર્કેટમાં પ્રભાવ પડી વેચવાલીથી માર્કેટ રેડઝોનમાં ઉતરી ગયુ શકે છે. હતું. પસંદગીના ધોરણે ફરી ધૂમ લેવાલી

મુંબઈ શેરબજારમાં અફડાતફડીના હતું અને અંતિમ તબકકામાં ફરી અટવાયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ત્રીજા તબકકાના ચૂંટણી મતદાન, વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલી, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ચેતવણી સહિતના કારણોથી ટોન સાવચેતીનો શેરબજારમાં આજે શરૂઆત બન્યો હતો. આવતીકાલના મતદાનના

શેરબજારમાં આજે ટેક મહિન્દ્ર, ઘટાડો હતો.

હિન્દ લીવર, ઈન્ડ્રસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફ્રોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મહીન્દ્ર, ટીસ્કો, બ્રીટાનીયા, ટીસીએસ, ટાટા મોટર્સ વગેરે ઉંચકાયા હતા. ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારૂતી, લાર્સન, રીલાયન્સ, સ્ટેટ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, ભારત પેટ્રો, આરઈસી, પાવર ફાઈનાન્સમાં



સોનાની જ્વેલરીની હરાજી માટે સમાચારપત્રમાં જાહેર સુચના બજાજ ફાઇનાન્સ લિમિટેડ

પંજીકૃત દફ્તર: મુંબઈ - પુણે રોડ, આકુર્ડી, પુણે - 411035

આથી તમામ સંબંધિત ઋણધારકો અને જાહેર જનતાને BFL દ્વારા સૂચિત કરવામાં આવે છે કે ગોલ્ડ લોન પ્રાપ્ત કરતી વખતે ઋણધારકો દ્વારા તેમના સંબંધિત લોન એકાઉન્ટમાં સોનાની જ્વેલરી ગીરવે મુકવામાં આવી છે અને તેઓ વારંવાર આપવામાં આવેલી નોટિસ છતાં પણ લોન રકમની પુનઃચૂકવણીમાં નિષ્ફળ ગયા છે અથવા જરૂરી માર્જિન પૂરું પાડવામાં નિષ્ફળ ગયા છે તેની 'જ્યાં છે ત્યાં અને જેમ છે તેમ પરિસ્થિતિમાં' હરાજી કરવામાં આવશે. બિડર્સને નીચેની શરતોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે:

- (ક) બાજુમાં આપેલા QR કોડને સ્કૅન કરીને જાહેર નોટિસ (લોન, જવેલરી, કુલ વજન, સ્થળ અને હરાજીની તારીખ)ની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત કરવી;
- (ખ) આ વેબલિંકની મુલાકાત લઇને આ જાહેર હરાજી સાથે સંબંધિત સંપૂર્ણ બિડર નિયમો અને શરતો (T&C') વાંચવી https://cms-assets.bajajfinserv.in/is/content/bajajfinance/bidder-tcpdf?scl=1&fmt=pdf;
- (ગ) નિયમો અને શરતો સમજવા માટે અને ત્યારબાદ હરાજીની તારીખે અથવા તે પહેલા કંડ ટ્રાન્સફર (NEFT/RTGS/બજાજ ગોલ્ડ ઑક્શન ઍપ) મારફતે ₹25,000/-ની બાનાની રકમ જમા કરવી;
- (ધ) હરાજીના સ્થળે સવારે 10 વાગ્યાં સુધીમાં વ્યક્તિગત રીતે હાજરી આપવી;
- (૬) હરાજીના સ્થળે તેમની ઓળખ અને સરનામાનો માન્ય પુરાવો લઈને આવે.
- (ચ) હરાજીના દિવસે બપોરે 12 વાગ્યા પછી બોલી લગાવનારાઓને હરાજીમાં ભાગ લેવા દેવાશે નહીં.
- (છ) ઉલ્લેખિત સમય મર્યાદામાં ભાગ ન લેનાર બોલી લગાવનારાઓએ અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) ચુકવી હોય તો પણ, તેમને પ્રવેશ આપવા કે નકારવાનો અધિકાર બ્રાન્ય મેનેજર/હરાજીકર્તા પાસે અબાધિત છે.



સ્કૅન કરો

જો હરાજીના સ્થળ અથવા તારીખમાં કોઇ ફેરફાર થશે તો તેને હરાજી કેન્દ્ર પર પ્રદર્શિત કરવામાં આવશે. તમારા દ્વારા રજૂ કરવામાં આવેલી બિડને ઉપરોક્ત નિયમો અને શરતોની સ્વીકૃતિ માનવામાં આવશે. જાહેર હરાજીથી વેચાણ મોકૂફી /રદ કરવાના પ્રસંગે, જેમ કે ઋણધારક(કો)ની રજૂઆત, BFL ખાનગી વેચાણ મારફતે જ્વેલરીનું વેચાણ કરવાનો અધિકાર અબાધિત રાખે છે. કોઇપણ પૂછપરછ માટે, તમે અત્રે આપેલા ઇમેલ ID પર અમારો સંપર્ક કરી શકો છો gold.auction@bajajfinserv.in

(10-05-24): અમદાવાદ - કુબેરનગર; PLB2GOL7020159. અમદાવાદ - વસ્ત્રાલ; POB2GOL6972820, 6973864, 6913408, 6869763. અમરેલી - સ્ટેશન રોડ; P4A9GOL7032569. આણંદ - AV રોડ; P431G0L6927407, 6967943, 6880254, 6857211, 7004753. અંજાર - વર્ષામેડી નાકા; P75QGOL6924712. બાબરા - રાજકોટ ભાવનગર હાઇવે; P05VGOL7022000, 6935437, 7033529, 7002054, 7035614, 7031192. GIGSI; PF36PFI6841984, 6949136, 6934848, 7000343, 6935061, 6987686. બારડોલી - આચાર્ય તુલસી માર્ગ; P4X7G0L6923081, 6956403, 7030508. ભુજ -હોસ્પિટલ રોડ; PB40G0L6940091, 6950664, 6846768, 7005657, 6934056. (11-05-24): બાવળા -સ્ટેશન રોડ; P06VG0L7019267. ભયાઉ - રામવાડી; P78QG0L6894521, 6949937, 6971683, 6857323, 6855457, 6861334, 6993567. ભરૂચ; P460G0L6947253, 6992257. ભાઠી - કરમ્બેલી; PG38PFI6535811. ભટલાઈ; PG28PFI6733762, 5515792. ભાવનગર - શાસ્ત્રીનગર રોડ; PB52G0L6866366, 6880007, 6911159, 6855597, 6854832, 6846621, 6881455. ભુજ - સ્ટેશન રોડ; P5F1G0L6849084, 6925826, 6892694, 6926064. ગાંધીનગર - પાટનગર; P576G0L6880463, 6767994, 6950152. જાફરાબાદ ગુજરાત; P18VGOL5456122. જસદણ - આટકોટ રોડ; P71QGOL7031763. (13-05-24) બોટાદ - એસટી ડેપો; P52JGOL6892672, 6968594, 6991533, 7021085, 6847969. 6986907, 6994589, 6914128. GIZIE - ZIGR RIS; PAU3GOL6934353, 7034606, 6869722, 6893567. બુજેઠા; PG22PFI6994023. દધીયાલ; PAG1PFI6541749, 6593682. દાહોદ - બસ સ્ટેશન રોડ; P4Y0G0L6988547, 6709153, 6589019, 6892544, 6975212, 6698229, 6861047. દમણ - એરપોર્ટ રોડ; P29GGOL6854812, 6830485. દહેમી; PAE3PFI6947150, 6652059. ધ્રાંગધ્રા - પોસ્ટ ઓફિસ; P73QG0L6923449, 7034930, 7025076, 7035275, 7003520, 7003847, 6992622, 7024777, 6948817. ଧାଁଦାନା - ନର୍ଗାକ୍ତ୍ରିର સର୍ନଗ; P74QGOL6944177, 6937701, 7020406, 7036179, 6994030, 6989755, 7002733, 6752426, 6911154. ડુંગરી; PG29PFI6945212, 6711791. દ્વારકા - પોસ્ટ ઓફિસ રોડ; P77QGOL6928271, 6891302, 6847069, 6975652, 7036171, 6961447, 6949397, 6896836, 6911658 6957798 7003331 6842570 มเยียม - พ่เดิม พาริ์ร: PF42601 6870355 6895279 6846937, 6870235, 7020978, 6882167, 6948686, 7030441, 6910042, 7020752, 6892539, 6939140. સિલ્વાસા - મેઇન રોડ; PB51G0L7019043, 6945597, 6913320, 7003897. (14-05-24) અંકલેશ્વર - રોશની પ્લાઝા; P4L2G0L6871232, 6943565, 6961086. ભાટિયા - બસ સ્ટેન્ડ; PF41G0L6958195. 6975809. 6913933. 6896535. 6935028. 7024351. 7019998. 7035793. 6891687, 6987053. ભાવનગર - વાઘાવાડી રોડ: P499GOL7018195, 7034263, 7001750, 6937894. 7019638, 6945609, 6914645. ગઢડા - બોટાદ રોડ; P72QGOL6908180, 6849222, 6849800, 6883526, 6881936, ગાંધીધામ - કચ્છ કલા રોડ: P542G0L6871912, 7021027, હલવડ - જીની કોમ્પ્લેક્સ: 6908946, 6848847. હારિજ - મેઇન બજાર; PD15GOL7021367. હિમતનગર - ઓલ્ડ સિવિલ હોસ્પિટલ રોડ; P500G0L6869081. જામજોધપુર; P57EG0L6969743, 6940335. જામનગર - ગોલ્ડન પ્લાઝા; P473GOL7005592, 7023545. (15-05-24) બરોડા - ગેંડા સર્કલ; P413GOL7030009, 6915442, 6856241, 6855301, 6855922, 6922252, જેતપર - જલારામ કપા; PB42GOL6947933, 6972968. જીતાલી; PG19PF17003657, 7035430, 6858483, 6881552. જૂનાગઢ - મોતી બાગ; PB64G0L6842235, 6913611, 6871706, 6946628, 6947964, 6861830, 6950926, 6990848. કાલાવડ - સિનેમા રોડ; P07VG0L6914885, 6972254, 6961876, 6989629, 6950637, 7030295, 6871119. કામરેજ; P4Z8G0L6926233, 6926702, 6925706, 6925891. કન્યાસી; PF34PFI6907959. કરમલ; PG75PFI6404873. ખંભાળિયા - જોધપુર ગેટ; P76HG0L6847739, 6938671, 7019809. 7016619, 6957470, 6858082, 6988932, 6962252, 6893595, 6922414. કોટામ્બી; PG35PFI5478102, 6513497, 6407234, 6526625, 6167698, 6913671, 6308957, 6711952, 6859301, 6873905. (16-05-24) કુતિયાણ - દેવડા નાકા; PF05G0L6962799, 6939854. લુણાવાડા -એસટી સ્ટેન્ડ; P09VG0L6948826, 6937607, 6935830, 6938433, 6854675, 7037221, 6958668, 6854556, 7031697, 6976163, 6914460, 6939232, 6937372, 6946323, 6995983, 6945067, 6976178, 6869970, 6946492. માધાપર - બસ સ્ટેશન રોડ; P71FGOL6871108, 6921863, 6949277, 6987268, 7023673, 6956732, 6845235, 6861823. મહુડી; PAF3PFI6993775, 6992838. મહુવા -આણંદ ધન કોમ્પ્લેક્સ; PW05G0L7022732, 6924735, 6950396. માંડવી - લાયજા રોડ; P10VG0L6963732, 6944493, 6968013, 6912146, 6855883, 7029198. भेनपुरा; PAF6PFI6724072, 6709747, 6646476. મોડાસા - માલપુર રોડ; P31GGOL6921468. મુન્દ્રા - ભુજ રોડ; P76QGOL7030032, 6849656. નવાગામ ઇસારી; PAE8PFI6537326. નવસારી - સચાજી લાયબ્રેરી રોડ; P433GOL6944394. પાલનપુર - આબુ હાઇવે રોડ; P4A5GOL6857276. પારસા જીજે; PAF4PFI6912427. પાટડી; P83UGOL6967757, 7037232, 7018847, 6976083, 6995432, 6783672. પોરબંદર - એમજી રોડ; P51JGOL6925173, 7020121, 6912752, 6869352, 6873501, 6970491, 6860414, 6855782, 6970638, 6971191. (17-05-24) પોરબંદર - એસવીપી રોડ; PB95G0L7019622, 7020760, 6968987, 7033498, 6971719, 6896985. રાધનપુર; P86UGOL6939475. રાજકોટ - ગોંડલ રોડ; PB80G0L7034605, 7000774, 6944600. રાજકોટ - કોઠારીયા રોડ; PF29G0L6928409, 6861602, 6895263. રાજુલા - તલાબ રોડ; P70QG0L7029989, 7019923, 6934115, 6934410, 6893474, 6973792, 6896111. રાપર - કોર્ટ રોડ; PF22GOL6987454, 6944872, 7029839. સુરત - પર્વત પાટિયા; PXB7G0L6990556. સુરત - સવાણી રોડ; P428G0L6935692, 6994509. તારાપુર - ખંભાત હાઇવે; PB46G0L6542908, 6892132, 6943495, 6960408, 6948284. (18-05-24): રાજકોટ - મવડી રોડ; PI83GOL6958199. સાંગલ; PAE9PFI6470601. સરવાણી; PG23PFI6374988, 5752810, 5780511. સાયલા - સુદામડા રોડ; PF21G0L6923189, 6873599, 6856728, 7030921, 6912393, 6912769, 6857214, 6925030, 6915718, 6866670, 6971987, 6169847, 6936333, 6956000. सिधेर -સરવૈયા કોમ્પ્લેક્સ; P28GGOL6804275, 7021904, 6988962, 6681990, 6950517, 6891256. સિંહુંજ; PAF7PFI6624884, 6949243. સુરેન્દ્રનગર - બસ સ્ટેન્ડ રોડ; P5J8GOL6973503, 7003955, 6975032, 6847624. ઉમરા; PG32PFI5755106. ઉના ગુજરાત; P80KG0L6857080, 6872809, 6844436, 6850046, 6873043, 7031859. 4SIERI - RIGURI; PB41G0L7032646, 6883397, 6894244, 6990637, 6907453, 6991837, 6868887, 6912313. (20-05-24) 4141; P584G0L6994859, 6924031. વરવાડા; PAG4PFI6894357. વાસણા; PAF8PFI6856464. વાસણા રાઠોડ; PAF5PF16956123. વેરાવળ - એસટી સ્ટેશન રોડ; P21IGOL6891553, 6894552, 6962399, 6844418, 7001834, 6950147, 6842927, 7023049, 6879637, 6974059, 6914507, 7019187, 7032509. વીરોલ; PAE6PFI6926155. વ્યારા; P4Z7GOL6016820. વાકાનેર - માર્કેટ ચોક; P08VGOL6873359,

બજાજ ફાઇનાન્સ લિમિટેડ

6935856, 6880305.

પાડાને વાંકે પખાલીને ડામઃ પાન-આધાર લિંક મામલે આઈટીએ વિક્રેતાને બદલે ઘર ખરીદનારને નોટિસ મોકલી નવી દિલ્હી તા.૬ દેશભરમાં લગભગ ૧૬ હજારથી વધુ તેમના પાન નંબર નિષ્ક્રીય છે અથવા કોઈ ભુલ નહોતી. તેમણે બધી કાનૂની આવકવેરા વિભાગ નવું ઘર ઘર ખરીદનારાઓને નોટીસ મોકલી તો આધાર સાથે લિંક નથી. પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું પણ ઘર ખરીદનારાઓને ટીડીએસ કપાત મામલે

ખરીદનારાઓને વિશેષ ટીડીએસ કપાતથી હાલ તરત રાહત આપી છે. તેના માટે સંપતિ વેચનાર વિક્રેતાએ ૩૧ મે સુધીમાં પોતાના પાન અને આધારને લિંક કરવાનો રહેશે. જો વિક્રેતા આમા ચૂકી જશે તો ખરીદનારે તેમની પાસેથી ખરીદી સંપતિ પર ચૂકવવો પડશે. આ મામલે અનેક લોકોને ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ પણ મોકલવામાં આવી છે.

ભોગવવા માટે

પશ તૈયાર રહે.

વિરુદ્ધ દાખલ

કરાયેલી અરજી

કેમ તેનો ખર્ચો ઉઠાવે?

એસી ચાર્જ વસૂલવા મુદ્દે હાઈકોર્ટમાં

પડકાર ફેંક્યો હતો. અરજીમાં

કહેવાયું હતું કે શાળા એસીના નામ

પર દર મહિને ૨૦૦૦ રૂપિયા

વધારાની ફ્રી વસૂલે છે. માતા

પિતાનો એવો તર્ક હતો કે

વિદ્યાર્થીઓને એસીની સુવિધા

આપવાની જવાબદારી શાળા

મેનેજમેન્ટની છે. આથી તેમણે

પોતાના ફંડથી તેનો ખર્ચો ઉઠાવવો

જોઈએ. જો કે હાઈકોર્ટે આ અરજી

મેનેજમેન્ટ એકલા એસીનો ખર્ચો

કેમ ઉઠાવે? વાલીઓએ પણ તેમાં

ફાળો આપવો જોઈએ. કોર્ટે એમ

કહીને અરજી ફગાવી કે એસી

બાળકોની સુવિધા માટે લગાવવામાં

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે શાળા

ફગાવી દીધી.

જવાબદારીઃ વિશેષજ્ઞોનું કહેવું છે કે આવકવેરા વિભાગે વિક્રેતાની જવાબદારી નકકી કરવી જોઈએ. તે પોતાના પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવે, નહીં કે ખરીદનારાઓ પર ટીડીએસનો બોજ નાખવામાં આવે.

નિશ્ચિત તારીખ સુધીમાં પાન-આધાર લિંક ન થવા પર વિક્રેતાને જ નોટિસ મોકલવી જોઈએ.

હાલ તુરંત ૩૧ મે સુધી રાહત આપી તેમની પાસેથી ખરીદી સંપતિ પર આ પરીસ્થિતિમાં ખરીદનારે આવકવેરાની નોટિસનો તેમને સામનો વધેલા દરથી વધારાનો ટીડીએસ તેમની પાસેથી વધારાનો ટેકસ વધારાના કરનું ચૂક્રવણું કરવું પડશે, કરવો પડે છે.

પણ હાલમાં જ જાહેર એક સકર્યુલરમાં વિભાગે આવા ઘર ખરીદનારાઓને ઉદ્લેખનીય છે કે ગત એક વર્ષમાં વિક્રેતાઓએ આ સંપતિ વેચી છે, રાહત આપીને પાન અને આધારને લિંક કરાવવા માટે ૩૧ મે ૨૦૨૪ સુધીનો સમય આપ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આનો મતલબ એ છે કે ખરીદનારે નોટિસ રદ કરાવવા માટે વિક્રેતાને પોતાના પાનને પોતાના

> કરવો પડશે. અનેક ખરીદનારાઓએ અદાલતનો દરવાજો ખખડાવ્યોઃ અરજદારોનું કહેવું છે કે આમાં તેમની

> આધાર સાથે લિંક કરવાનો આગ્રહ

PROCLAMATION REQUIRING ATTENDANCE OF DEFENDANT (ORDER 5, rule 20 of the Code of Civil Procedure) In the Court of Sh. Mukesh Kumar Gupta District Judge, Commercial Court-07 (Central) Room No. 302, Extension Block, Tis Hazari Courts, Delhi

CS (COMM) 604/2022 M/s Suresh & Sons Versus M/s Jai Ambey Dry Fruits M/s Jai Ambey Dry Fruits & Spices Regd. At: A-201, Swapna Sangin B/H Nandanvan-2, VIP Road, Surat, Gujarat-395007 Email: kbdp.co@gmail.com Mobile No. 7878711777

Through Its Proprietor Sh. Jignesh Bhikhu Bhai Jariwala WHEREAS you are intentionally evading service of summons it is hereby notified that if you shall not defend the case on the 27-05-2024 the day fixed for the final disposal, it will be heard and determined ex-parte. GIVEN under my hand and the seal of the court, this 02-04-2024.

District Judge, Commercial Court-07 (Central Seal) Tis Hazari Courts, Delhi

ELECON GEARING THE FUTURE

એલીકોન એન્જીનીચરીંગ કંપની લિમીટેડ

CIN: L29100GJ1960PLC001082 રજીસ્ટર્ડ ઓફિસ: આણંદ-સોજીત્રા રોડ,વલ્લભ વિદ્યાનગર-૩૮૮ ૧૨૦. Ph: (02562) 236609, 236602. Email: investor.relations@elecon.com Website: www.elecon.com

> નોટિસ (કંપનીના ઇક્વિટી शेरधारકોના ध्यान भाटे)

વિષય : (੧) જે શેરધારકોને ડિવિડન્ડ ચુકવવાનું બાકી રહેલ છે અથવા જેમણે ડિવિડન્ડ નો દાવો કરેલ નથી તેમની માટે સ્મૃતિપત્ર. (२) रंपनीना वंस्पिटी शेरोने वंन्वेस्टर એજયુકેशन એन्ड प्रोटेंडशन इंड (આઈઈપીએફ) માં તબદીલ કરવા માટે.

(3) શેરધારકોની પાન અને બેંકની વિગતોને ફરજીયાત પણે ફેરફાર કરાવવા બાબત કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૨૪(૬) ની જોગવાઇઓ મુજબ સાથે ઇન્વેસ્ટર એજસુકેશન અને પ્રોટેક્શન રૂંડ ઓથોરિટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફર અને રીફંડ) નિયમો, ૨૦૧૬ ('નિયમો') જે ધ મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ) ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે અને તેના પછીના સુધારા મુજબ નોટિસ આપવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૯ કરિયા જાહેર કરાયેલ ડિવિડન્ડ, જેના ઉપર સાત વર્ષ સુધી દાવો થયેલ નથી તે આઇઇપીએફ માં જમા કરવામાં આવશે. આ અનુરૂપ શેર કે જેના ઉપર સતત સાત વર્ષ સુધી ડિવિડન્ડ ચુકવાયેલ નથી અથવા દાવો કરવામાં આવેલ નથી તે નિયમોમાં સૂચિત

કાર્ચવાહી મુજબ તબદીલ કરવામાં આવશે. કંપની દ્વારા એવા શેરોને આઈઈપીએફ માં તબદીલ કરવામાં આવશે નહીં જેના ઉપર કોર્ટ / ટ્રિલ્યુનલનો કોઈ ચોક્ક્સ આદેશ ફરમાવવા માં આવ્યો હશે જે આવા શેરોની તબદીલી ને અટકાવશે અથવા કિપોઝિટરીઝ ધારા, ૧૯૯૬ હેઠળ આવા શેરો ને ગીરો મુક્લામાં આવ્યો હશે.

કંપનીએ સંબંધિત શેરધારકો કે જેમના શેર આઇઇપીએફ ના નિયમો હેઠળ તબદીલ કરવા માટે જવાબદાર છે, તેમને ચોગ્ય પગલાં લેવા માટે વ્યક્તિગત રીતે પત્રવ્યવહાર

શેરદારકો કે જેમણે નાશાંકીય વર્ષ ૨૦૧૬-૧७ થી ડિવિકન્ડ ચુકવાયેલ નથી અથવા દાવો કરેલ નથી, તેઓ ને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ લિન્ક ઈન્ટાઈમ ઈન્ડીયા પ્રાઈવેટ લિમીટેડ ને ડિવિડન્ડ નો દાવો કરવા માટેની અરજી કરીને આઇઈપીએફ માં તબદીલ થાય તે પહેલા મેળવી લેવામાં આવે.

લાગતા વળગતા શેરધારકો કે જેઓ તેમના શેર ભૌતિક સ્વરૂપે ધરાવે છે અને જેમના શેરોને આર્શ્કપીએફ ખાતે તબદીલ કરવાને પાત્ર છે તેઓ નોંઘી હે કે તેમણે ધારણ કરેલ અસલ શેર સર્ટીફીકેટની સામે કંપની નવા શેર સર્ટીફીકેટ જારી કરીને તેમને ડિમેટ ફોર્મમાં પરિવર્તિત કરશે અને તેને તુરંતજ આઈઈપીએફ ઓથોરીટી દ્વારા શરૂ કરાવેલ ડિમેટ ખાતામાં તબદીલ કરવામાં આવશે. આ શેર જારી થવાથી અસલ શેર સર્ટીફીકેટ જે શેરધારકોના નામે નોંધાયેલા છે. તે સ્વયં रह थशे अने ते रहलातल भानी लेवामां आवशे. 🕈 शेरधारको तेमना शेरने ડિમેટ ફોર્મમાં ધરાવે છે તે કિસ્સામાં શેરોને તેમના ડિમેટ ખાતા માંથી તબદીલ કરવા કંપની દ્વારા આઈઈપીએફ ઓથોરીટી જે હવે પછી જે સૂચન કરે તે અનુસાર કોર્પોરેટ એક્શન દ્વારા સંબંધિત ડિપોઝીટરીને જાણ કરવામાં આવશે.

જો કંપનીને સંબંધિત શેરધારકો પાસેથી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલા કોઇ સંચાર સ્વરૂપ પ્રાપ્ત નહીં થાય તો કંપની તેવા રોરોને આઇઇપીએક ઓથોરીટી સાથે જમા કરાવશે. આ શેરો ઉપર ડિવિડન્ડ જાહેર કરવામ આવશે, તો તે પણ આઇકપીએફ ખાતે જમા કરવામાં આવશે. શેર અને તેનું ડિવિડન્ડ આઇકપીએફ ખાતે તબદીલ થયા પછી કંપની સામે તે સંદર્ભે કોઇપણ દાવો કરી શકાશે નહી.જો કોઇ શેરધારકોને તેનો દાવો કરવો હોય તો આઇઇપીએફ નિયમોમાં જણાવ્યા મુજબ આઇઇપીએફ ઓથોરીટીને અરજી કરી શકે છે. દાવો કરવાની પ્રક્રિયા આઈઇપીએફ ની વેબસાઈટ www.iepf.gov.in

સેબી ના પરિપત્રો મુજબ, શેરધારકો ના ખાતાવાળા ફોલિયો કે જેને પાન, ઇમેલ આઈડી, નોમીનેશનની વિગતો અને બેંક ખાતાની વિગતો સાથે જોડવામાં આવ્યા નથી, તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફરજીયાત પણે સંબંધિત ફોલિયો(ઓ) ની વિગતોની નોંધણી કરાવવા માટે કંપનીના આરટીએ ને આપે.

શેરધાસ્કોને ઉપરોક્ત બાબત અને તેના નિયમો અંગે કોઈપણ બાબતની સમસ્થા હોય તો તે કંપનીને ઉપર જણાવેલ સરનામે અથવા કંપનીના રજાસ્ટાર અને શેર ટાન્સકર એજન્ટને નીચે જણાવેલ સરનામે સંપર્ક કરવા વિનંતી.

લીંક ઇનટાઇમ ઇન્ડીયા પ્રા. લી., યુનીટઃ એલીકોન એન્જીનીયરીંગ કંપની લી., ગીતા હુંજ, ૧ ભક્તિનગર સોસાયટી, એ બી એસ ટાવરની પાછળ, જુના પાદરા रोड, वडोहरा-३६००१५. होल; + ६९ २५५ - ३५५५७६८. ઇમેઇલઃ vadodara@linkintime.co.in વેબસાઈટ: www.linkintime.co.in

એલીકોન એન્જીનીયરીંગ કંપની લિમીટેડ વતી २८०० : वस्त्रक विद्यानगर

તારીખ : ૬ ફ્રી મે, ૨૦૨૪.

દિલ્હીના કેશવપુરમમાં બે બાળકોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા

નવી દિલ્હી, તા. દ દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં એક પિતાએ પોતાના બંને બાળકોની હત્યા કરી નાખી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતાએ બાળકોને કાં તો ઝેર આપ્યું અથવા તેનું ગળું દબાવ્યું. બંને બાળકોના શરીર પર હળવા ઇજાના નિશાન પણ છે. પિતા પોતે બપોરે બંને બાળકોને શાળાએથી લઈ આવ્યા હતા. દિલ્હીના કેશવપુરમમાં શંકાસ્પદ સંજોગોમાં બે બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પિતાએ જ પોતાના બંને સંતાનોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા શા માટે અને કેવી રીતે થઈ તે હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝેર અને ગળું દબાવવા જેવી બાબતો પ્રકાશમાં આવી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ જ સ્પષ્ટ થશે કે આ બંનેની હત્યા કેવી રીતે કરવામાં આવી. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

torrent

કાર્યવાહક મુખ્ય

પ્રીતમ સિંહ

અરોડાની બેન્ચે

એડમિશન કરાવતા પહેલા નિયમો,

ન્યાયાધીશ

ટોરેન્ટ પાવર લિમિટેડ નોટીસ

પ્રાહકોને ગુણવત્તાભર્યો અને વિશ્વસનીય વીજપૂરવઠો સતત અને સુનિશ્ચિતપણે મળતો રહે તે માટે નેટવર્ક મેઇનટેનન્સનું આયોજન કરેલ છે. નીચે દર્શવિલ સબસ્ટેશનો/પોલ માઉન્ટેન્ડ ટાન્સફોર્મરમાંથી વીજપરવઠો મેળવતા ગ્રાહકોનો સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન વીજપુરવઠો બંધ થવાની શક્યતા છે. આપની પ્રવૃત્તિઓનું આયોજન તે મુજબ કરવા વિનંતી. તા.૦૯/૦૫/૨૦૨૪, ગુરુવાર (૧) સરખેજ ગામ: સરખેજ તળાવ-TR, (૨) ફતેહવાડી વાસણા:

વર્ધમાન ફ્લેટ (ક્લ્પેશ)-TR, (૩) <u>આનંદ નગર સેટેલાઈટ</u>ઃ સફલ પેગાસસ-TR-૧, (૪) <u>મહાલક્ષ્મી</u> <u>ચાર રસ્તા:</u> શહજ બાગ-TR, (૫) <u>જીઆઈડીસી વટવા PH-૪:</u> રૂપાબેન ભરવાડ-SS, (*૬*) <u>લાંભા ગામ:</u> NIDC-SS, નંદલિયા કોર્પોરેશન-PMT, રશ્મિ વિહાર-TR-૨, (૭) <u>મેઘા**ન્નીનગર:**</u> આદર્શ સોસાયટી-TR, નેતાજી નગર-1-TR, નેતાજી નગર-2-TR, નેતાજી નગર-TW-TR, અંબિકા નગર બોર પંપ (મેઘાણીનગર)T, લક્ષ્મી નગર-૨ (NW લક્ષ્મી નગર)-TR, (૮) <u>ઉસ્માનપુરાઃ</u> આદિત્ય-૪-PS, (૯) <u>બલોલ નગર રોડ</u> <u>રાણીપઃ</u> એએમસી ક્વાટર્સ-૨ (બલોલ નગર).<u>તા.૧૦/૦૫/૨૦૨૪, શુક્રવાર</u> (૧) <u>પંચવટીઃ સાઈ</u> <u>ગુલશન-SS,</u> (૨) <u>વિજય ચાર રસ્તાઃ</u> ધ એડ્રેસ CSS-TR-૧, (૩) <u>૧૦૦ ફ્રૂટ સેટેલાઈટ રોડઃ</u> સચિન ટાવર, (૪) <u>જજી**સ બંગ્લોઃ**</u> રત્નમ ટાવર-TR, (૫) <u>નારોલ ગામઃ</u> ક્રિષ્ના કોમ્પ્લેક્સ (નારોલ)-PMT, ફ્રી વે ટ્રેડ સેન્ટર-SS, (૯) રાયપુરથી કાંકરિયા રોડ: સિટી સેન્ટર-૨-SS, (૭) <u>ભૈરવનાથ રોડ મણિનગર</u>: એમ્પાયર ક્રેસ્ટ-CSS, (૮) <u>રબારી કોલોની નેશનલ હાઈવેઃ</u> રામેશ્વર પાર્ક-PMT (ઓઢવ)-PMT, (૯) <u>મહાદેવનગર ટેકરાથી વસ્ત્રાલ</u>: મહાદેવનગર કૂવો-૨-TR, ક્રિશ બંગ્લો (જીઆર-II)-TR (૧૦) <u>ગાંધીનગરઃ</u> એમરાલ્ડહોન્ડા, (૧૧) <u>ચેનપુર ગામઃ</u> વંદેમાતરમ હોમ્સ (ચેનપુર)-TR. **અસુવિદ્યા બદલ દિલગીર છીએ**

ADINATH EXIM RESOURCES LIMITED CIN: L65100GJ1995PLC024300

601, Astron Tower, Opp. Iskon Mandir, Nr. Casalla Tower, Satellite, Ahmedabad-380015, Gujarat Ph. 6351738619 E-mail: aerlnodalofficer@gmail.com Website: www.adinatheximresources.com EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2024

			(R:	s. In Lacs except	Per share data
Standa			lone		
Sr	Dominulana	Quarter Ended	Quarter Ended	Year Ended	Year Ended
No	Particulars	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
		(Audited)	(Audited)	(Unaudited)	(Audited)
1	Total Income from Operation(Net)	26.16	25.17	103.46	99.73
2	Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	19.40	20.96	74.09	67.92
3	Profit / (Loss) for the period after Exceptional (before tax and Extraordinary items)	19.40	20.96	74.09	67.92
4	Profit / (Loss) for the period after Exceptional and/or Extraordinary items (before tax)	14.52	34.71	55.57	67.92
5	Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	53.84	13.21	228.74	68.11
6	Equity Share Capital	431.91	431.91	431.91	431.91
7	Other Equity	0.00	0.00	1470.84	1242.20
8	Earning Per Share (Face Value of ₹10/- each)	555555555		500000000000000000000000000000000000000	
	Rasic & Diluted	0.34	0.80	0.29	1 58

(1) The above is an extract of the detailed format of Audited Standalone Financial Results for the Quarter and Year ended on March 31, 2024 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligation and Disclosures Requirements) Regulations, 2015. The full format of Audited Standalone Financial Results for the Quarter and Year ended on March 31, 2024 are available on the Company's website www.adinatheximresources.com and website of the Stock Exchang

(2) The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on May 06, 2024.

Place : Ahmedabad Date : 06.05.2024





For, ADINATH EXIM RESOURCES LIMITED



Manoj S. Savla Managing Director

(DIN: 01529306)

ભારતી ઈસરાણી (કંપની સેકેટરી)

